https://archive.org/details/bk873/page/n0/mode/1up

1953-09-06 -Virani Sarvajanik Vidyalay (873)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

ॐ

॥ सा विद्या या विमुक्तये ॥

શ્રી વિરાણી સાર્વજનિક વિદ્યાલય

વિરાણી-(કચ્છ)

卐

મકાન બાંધકામ ફંડનો

હિસાબ અને અહેવાલ.

પ્રકાશક : વિરાણી સાર્વજનિક સ્કૂલ કમિટિ.

ઉદ્ઘાટન સમારંભ તારીખ ૬ સપ્ટેમ્બર ૧૯૫૩

realpatidar.com

https://archive.org/details/bk873/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 3, 7.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk873/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.19 17:37:37 +05'30'

realpatidar.com

ॐ

॥ सा विद्या या विमुक्तये ॥

શ્રી વિરાણી સાર્વજનિક વિદ્યાલય

વિરાણી-(કચ્છ)

卐

મકાન બાંધકામ ફંડનો

હિસાબ અને અહેવાલ.

પ્રકાશક : વિરાણી સાર્વજનિક સ્કૂલ કમિટિ.

ઉદ્દ્ઘાટન સમારંભ તારીખ ૬ સપ્ટેમ્બર ૧૯૫૩

realpatidar.com

https://archive.org/details/bk873/page/n3/mode/1up

realpatidar.com

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk873/page/n4/mode/1up

1953-09-06 -Virani Sarvajanik Vidyalay (873)

realpatidar.com

ॐ

શ્રી વિરાણી સાર્વજનિક વિદ્યાલય

વિરાણી-(કચ્છ).

—★—

સ્થાપના તથા આવક જાવકનો અહેવાલ.

નિવેદન

॥ यादृशी भावना यस्य सिध्धिर्भवति तादृशी ॥

જેને જેવી ભાવના તેને તેવીજ સિધ્ધિ પ્રાપ્ત થાય છે.

એ સુત્રાનુસાર પરમદયાળુ પરમાત્માની કૃપાથી વિરાણીવાસીઓની "પોતાની શ ળા" ની ભાવના ફળી છે. કેળવણીના ક્ષેત્રમાં આપણો દેશ બીજા દેશોના મુકાબલે પાછળ ગણાય છે. પરંતુ તેમાંયે કચ્છમાં કેળવણીનું પ્રમાણ તો ઓછુંજ રહ્યું છે. કેળવણીમાં પછાત એવા કચ્છમાં પણ વર્ષો પહેલાં વિરાણીવાસીઓએ પોતના ગામમાં પોતાનુંજ એક વિદ્યાલય બને એવી ભાવના રાખેલી. આજથી વર્ષો પહેલાં એ ભાવનાના પ્રતિકરૂપે કચ્છની નખાત્રાણા કચેરીમાં ૭૨૦૦ કોરી ભરેલી. પરંતુ તે સમયની રાજકીય અને બીજી પરિસ્થિતિઓને કારણે વિરાણી શાળાના સ્વતંત્ર મકાન વગરજ રહ્યું.

વિરાણીની જુની નાનકડી શાળામાં પણ માત્ર ગુજરાતી પ્રાથમિક કેળવણીજ અપાતી. ગામવાસીઓની ઇચ્છા હતી કે પોતાના ગામમાં અંગ્રેજી વર્ગો પણ ચાલુ થાય. અને એ ઈચ્છાની સફળતાના નિમિત રૂપ શ્રી નારાણભાઈ શીવજી નાકરાણી બન્યા, એમણે રૂા. ૬૫૦૦ની માતબર રકમ હજુર ઓફિસમાં ભરી, અને ૧૯૪૫માં વિરાણીનાં બાળકોને અંગ્રેજી ત્રણ ધોરણ ભણવા માટેની વ્યવસ્થા થઈ, પરંતુ શાળાના પોતના મકાનની ભાવના તો અપૂર્ણજ રહી.

realpatidar.com

https://archive.org/details/bk873/page/n5/mode/1up

realpatidar.com

૧ વિરાણીવાસીઓનો નિર્ણય.

એ પછી તો સ્વરાજ્ય મળ્યું. આઝાદીનું પ્રભાત ઉગ્યું અને આપણા દેશમાં આપણું રાજ્ય સ્થપાતાં જનતાની ઇચ્છાઓ પ્રબળ બની. વૈજ્ઞાનિક જમાનાના જગતમાં ભારત પોતાનું માનભર્યું સ્થાન મેળવે એવી અનેક યોજનાઓ અમલમાં આવવા લાગી. શિક્ષણના ક્ષેત્રમાં પણ ભારત સરકારે યોજનાઓ ઘડી, ગામડે ગામડે શાળાઓ સ્થપાય એવી સરકારની ઇચ્છા યોજનારૂપે આગળ વધતી હતી. પરંતુ વિરાણીના આગેવાનો, વિરાણીના ધનવાનો, વિરાણીના શિક્ષિત યુવાનો અને વેપારીઓ સૌ કોઈની ઇચ્છા હતી કે આપણાં ગામમાં આપણેજ શાળાનું મકાન ઉભું કરવું. અને તેઓ એ પણ જાણતા હતા કે यत्नेन सिध्यंति कार्याणि न च मनोरथैः અર્થાત માત્ર કલ્પનાઓથીજ કાર્ય સરતું નથી પ્રયત્નથીજ થાય છે. એથી આપણે આપણે પૈસેથીજ શાળા તૈયાર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ; અને સેવાભાવી વિરાણીવાસીઓએ એનો નિર્ણય પણ કરી લીધો. આ નિર્ણયનો યશ કોઈ એકાદ વ્યકિતને આપવા જેવો ભેદ વિરાણીવાસીઓમાં નથી. વિરાણી સમસ્ત વિરાણીવાસીઓનું છે અને વિરાણીના પ્રત્યેક શુભકાર્યમાં એકેએક વિરાણીવાસીનો હિસ્સો છે. એમ માનવા છતાંય આ શુભકાર્યની શરૂઆત કરનારાઓમાં બે ભાઈઓના નામનો નિર્દેશ કરવો જરૂરી છે. તે શ્રી નારણ શીવજી નાકરાણી અને મનજી નારાણ લોહાર, આ બે ભાઇઓના ઉત્સાહ અને પ્રયત્નભર્યા સહકારથીજ આ કાર્ય શરૂ થઈ શક્યું છે એમ કહેવામાં અતિશયોકિતનો ભય નથી. વિરાણીમાં જન્મનાર દરેક વિરાણીવાસીને શીરે પોતાની સેવા આપવાનું ઋણ છેજ. પરંતુ ઉપરોકત બંને ભાઇઓના ઉત્સાહ અને પ્રયત્ન માટે વિરાણી એમનું ઋણી છે.

મકાન બાંધવાના નિર્ણય સાથેજ નાણાં અને જમીનના પ્રશ્નો ઉભા થયા, કચ્છ રાજ્યના સેવાભાવી પ્રોજેકટ ઓફિસર શ્રી જોહીજી સાહેબના પ્રયત્ન અને સહકારથી મે. કલેકટર સાહેબે ગામવાસીઓના ઉત્સાહની કદર કરી શાળાના મકાન માટે મફત જમીન અપાવી. એ માટે આપણે કલેકટર સાહેબના અત્યંત આભારી છીયે. જમીન મળ્યા પછી મકાનના બાંધકામ માટે નાણાનો સવાલ રહયો, પરંતુ જમીન મળી ગયા પછી વિરાણીની જનતાનો ઉત્સાહ વધી ગયો અને મકાન બાંધવા માટે નાણાં આપવામાં જાણે હરીફાઇ જામી. અમને જણાવતાં આનંદ થાયછે કે આવી સ્પર્ધાને કારણેજ આજે વીરાણી સાર્વજનિક વિદ્યાલયનું જે મકાન ઉભું છે તે શકય બન્યું છે. અમને તો લાગે છે કે, કચ્છમાંજ નહિ પરંતુ સરખામણી કરીએ તો કદાચ દેશભરમાં આટલી વસ્તીવાળા ગામમાં આવું ભવ્ય, સુંદર અને સગવડતાવાળું શાળાનું મકાન ભાગ્યેજ જોવા મળશે.

realpatidar.com

https://archive.org/details/bk873/page/n6/mode/1up

realpatidar.com

વિરાણી સાર્વજનિક વિદ્યાલય.



ઉદ્ઘાટન : વિદ્યાલયનું ભવ્ય મકાન. : ૬-૯-૫૩

realpatidar.com

https://archive.org/details/bk873/page/n7/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk873/page/n8/mode/1up

1953-09-06 -Virani Sarvajanik Vidyalay (873)

realpatidar.com

૨ ઉત્સાહ અને શ્રમ.

આવું મકાન માત્ર જમીન અને પૈસાથીજ ઉભું ન થઈ શકે ! એ માટે જોઇએ અદમ્ય ઉત્સાહ અને અંગ મેહનત, વિરાણીની જનતામાં એ ઉત્સાહ, ધગશ, એ સહકાર અને શ્રમસહિત કામ કરવાની તત્પતરતા હતાં, એથીજ આ મકાન તયાર થયું છે અને એ માટે સહુ ગ્રામવાસીઓનો–કે જેમના તનથી, મનથી કે ધનથી આ મકાન તૈયાર થયું એ સૌનો–ઉપકાર માનીએ છીએ. વિરાણીની શાળા વિરાણીના ગૌરવની વાત છે.

ગામ લોકોના ઉત્સાહ અને આનંદના પુરાવારૂપ તો શાળાના મકાનના ઉદ્ઘાટનનો દિવસ હતો, જેમણે તા. ૬ઠી સપ્ટેમ્બર ૧૯૫૩ના દિવસનો એ સમારંભ જોયો હશે તેઓ કબુલ કરશે કે વિરાણીના ઈતિહાસમાં એ દિવસ અપૂર્વ હતો. સવારથીજ શાળાના વિશાળ આંગણામાં આબાલ વૃદ્ધ વિરાણીવાસીઓનો માનવ સમુદાય હિલોળે ચઢયો હતો. ભણતાં ને નભણતાં બાળકોના કિલ્લોલથી મેળાવડો ગુંજી રહયો હતો, પોતાના ગામમાં આવી સુંદર શાળા થવાથી મોટેરાંઓ આનંદમાં મગ્ન હતાં, કાર્યકરો આજના મહેમાનોનું સ્વાગત કરવાના શુભ અવસરનો આનંદ અનુભવી રહયા હતા, આમ વિરાણી ગામજ એ દિવસે અનેરા આનંદમા તરબોળ હતું

૩ ઉદ્‌ઘાટન સમારંભ.

સમારંભની શરૂઆત કરતાં સ્વાગત પ્રમુખ શ્રી રતનશી ખીમજીએ આમંત્રિત મહેમાનો અને ગામબંધુઓનો હર્ષભર્યો સત્કાર કરતાં જણાવ્યું હતું કે "વિરાણી ગામ આજે સંતોષ અને ગૌરવ અનુભવે છે કે તેણે પોતાને આંગણે પોતાનાં બાળકો માટે શાળાનું સ્વતંત્ર મકાન બંધાવ્યું છે. આ કામ ગામના એકેએક માણસનું હતું અને સૌએ મળીને એ કર્યું છે એમાં કોણ કોનો ઉપકાર માને ? છતાં જયારે જયારે જરૂર પડી છે ત્યારે ત્યારે જે જે ગામવાસી ભાઈઓએ અને રાજ્ય કર્મચારીઓએ અમને સલાહ અને સહકાર દ્વારા જે પ્રોત્સાહન આપ્યું છે તે ભૂલાય તેમ નથી. દાખલા તરીકે શ્રી જેઠીજી સાહેબે વખતો વખત પોતાના સમય અને શક્તિનો ભોગ આપી આ કામમાં સહાયતા કરી છે. શ્રી ધાટગે સાહેબની મમતા પણ ઓછી નથી. અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમને થંભાવીને વિરાણીના ઉત્સાહ અને શ્રમની કદર કરી, આજના પ્રસંગે ખાસ હાજરી આપી છે એ માટે સૌની વતી આ તકે હું એમનો આભાર માનું છું. વળી આજના સમારંભના માનનિય પ્રમુખ શ્રી.ભવાનજીભાઈએ પણ મારી વિનંતી નો હર્ષભેર સ્વીકાર કરી, પોતાની દીલ્હીની જરૂરી મુસાફરી બંધ રાખી આજના સમારંભનું પ્રમુખસ્થાન લેવા કબુલ કર્યું એ આપણા ગૌરવની વાત છે. એમનો એ

realpatidar.com

https://archive.org/details/bk873/page/n9/mode/1up

realpatidar.com

આભાર ભુલાય તેમ નથી. શ્રી શીવદાસભાઈ કાનજીએ પોતાના ધંધાનાં કેટલાંક ખાસ કામોને અળગાં મુકી મારી સાથે નાગપૂર જેટલે દુર વસ્તા વિરાણીવાસીઓની રૂબરૂ જઈ નાણાંકિય સહાયતા માટે જે મહેનત કરી છે એમનો ઉપકાર માનવાની પણ તક લઉં છું." આ પછી સ્વાગત પ્રમુખે નાણાંકિય સહાય કરનારાઓના નામની યાદી રજુ કરી હતી, જે આ રીપોર્ટમાં અન્યત્ર પ્રગટ કરી છે.

સમારંભના પ્રમુખ શ્રી ભવાનજીભાઈએ ગામનાં સંગઠન અને સેવાભાવની પ્રશંસા કરી, આવાં સુંદર કામ બદલ અભિનંદન આપ્યાં હતાં. અને કચ્છની કેળવણીને લગતા પ્રશ્નોનો તથા આ બાબતમાં સરકાર શું શું કરી શકે અને કરશે એનો સુંદર શબ્દોમાં ખ્યાલ આપ્યો હતો.

આ પછી તાળીઓના ગડગડાટ અને હર્ષનાદો વચ્ચે શાળાનું મકાન ખુલ્લું મૂકતાં કચ્છ રાજ્યના કમીશ્નર સાહેબ શ્રી ઘાટગેએ ગામની એકતા, ભાવના અને શ્રમની પ્રશંસા કરી આવું સુંદર અને ભવ્ય મકાન શાળાને ભેટ આપવા બદલ ધન્યવાદ આપ્યો હતો.

કચ્છના સલાહકાર શ્રી પ્રેમજી ભવાનજીએ આવાં સુંદર કામ બદલ વિરાણી ગામને ધન્યવાદ આપી અને બીજાં ગામો પણ વીરાણીને પગલે ચાલે એવી ભલામણ કરી હતી. ત્યાર બાદ નખત્રાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી તુલસીદાસ ઠક્કર, શ્રી જુગનરામ રાવળ, શ્રી. મનસુખભાઈ ગઢવી, શ્રી. શીવદાસભાઈ કાનજી વગેરેએ પણ પ્રસંગોચિત પ્રવચનો કર્યાં હતાં. અંતમા ફુલહાર અને આભાર દર્શન સાથે હર્ષનાદો વચ્ચે મેળાવડો વિસર્જન થયો હતો. અને ત્યારબાદ મહેમાનો ભોજન લઈ વિદાય થયા હતા.

૪ સરકારનો સહકાર.

અમને જણાવતાં આનંદ થાય છે કે વિરાણીની આ શાળાના ઉપયોગ અને જાળવણી માટે કચ્છની સરકાર તરફથી કેટલીક લેખિત બાંહેધરીઓ મળી ગઇછે. જેમકે શાળા સાથે બંધાયેલ દવાખાનું, પુસ્તકાલય, કન્યાશાળા વગેરે મકાનોનો ઉપયોગ સરકાર બીજાં કામમાં કરશે નહિ, વળી શાળાના બાંધકામ માટે નાણાંકિય સહાય કરનારાઓમાં ૨૫૧ રૂા. કે તેથી વધુ મદદ કરનાર વ્યકિતઓના નામની આરસની તકતી કાયમને માટે મકાનમાં રાખવામાં આવશે. એ સિવાય પણ બીજી માગણીઓનો સરકાર તરફથી લેખિત સ્વીકાર કરવામાં આવ્યો છે અને એ માટે સંતોષ સાથે અમે રાજ્યના કર્મચારીઓનો આભાર માનીએ છીએ.

realpatidar.com

https://archive.org/details/bk873/page/n10/mode/1up

realpatidar.com

સાર્વજનિક વિદ્યાલય ઉદ્‌ઘાટન તા. ૬-૯-૫૩



કચ્છ રાજ્યના કમિશ્નર શ્રી. ઘાટગે સાહેબ વિદ્યાલયનું મકાન ખુલ્લું મૂકે છે.

realpatidar.com

https://archive.org/details/bk873/page/n11/mode/1up

realpatidar.com

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk873/page/n12/mode/1up

realpatidar.com

૫ વિરાણીવાસીઓને વિનંતિ.

સાથે સાથે વિરાણીની પ્રજાને આ પ્રસંગે અમે એક નમ્ર વિનંતિ કરીએ છીએ કે સંઘબળ અને ઉત્સાહથી મહાન કાર્યો પણ સરળ બની જાય છે એનું પ્રત્યક્ષ પ્રમાણ આપણી શાળાનું મકાન છે. એજ રીતે કાર્યો સવેળા અને સરળતાથી થઈ શકે છે. આ કાર્ય પછી પણ આપણી સામે ખુબ કામ પડયાં છે, વિરાણીને આપણે એક આદર્શ ગામ બનાવવા માગીએ છીએ. શાળાનું મકાન એ એની શુભ શરૂઆત છે. દવાખાનુ પુસ્તકાલય, સ્વચ્છ અને પાકા રસ્તાઓ, એવુ બધું વિરાણીમાં હોવું જોઈએ, દવાખાનું અને પુસ્તકાલયનાં મકાનો તો તૈયાર છેજ; એમાં આપણે સાધનો પણ વસાવવાં જોઈશે. વિરાણી-નખત્રાણાના રસ્તાનું કામ થોડા વખતમાં શરૂ થશે. મોટરના સ્ટેન્ડ માટે પણ નક્કી થઈ ગયું છે. પણ આ બધું કરવા માટે આપણેજ પ્રયત્ન કરવો પડશે. આપણે જોઈ લીધું છે કે આપણી પાસે કામકરવાની ધગશવાળા માણસો છે, અને તેમનું નેતૃત્વ સંભાળી લે એવા અનુભવીઓ પણ છે. ઉપલાં બધાં કામ આપણે શાળાની જેમ ઉત્સાહથી પૂરાં કરીશું ત્યારે વિરાણીને આદર્શ ગામ બનાવવાનું આપણું સ્વપ્ન પણ સફળ થશે એ·વાત ભૂલશો નહિ.

અંતમાં આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર ગામના કે બહારના સૌ ભાઈઓનો આભાર માની આવોજ સહકાર ચાલુ રાખવા વિનતિ કરીએ છીએ. અને નાણાકિય સહાય આપનાર શુભેચ્છકોની અન્યત્ર છપાયલી નામાવલિ તરફ વાંચકોનું ધ્યાન ખેંચીએ છીએ.

અહેવાલ ધાર્યા કરતાં મોડો બહાર પડે છે એ માટે સૌની ક્ષમા યાચીએ છીએ.

લી. સેવકો

વિરાણી-(કચ્છ).

રતનશી ખીમજી ખેતાણી
મનજી નારણજી લોહાર
ખીમજી દેવીદાન ગઢવી
શીવદાસ કાનજી પટેલ
નારાણ શીવજી નાકરાણી

realpatidar.com

https://archive.org/details/bk873/page/n13/mode/1up

realpatidar.com

શ્રી વિરાણી સાર્વજનિક વિદ્યાલય

મ કા ન બાં ધ કા મ ફં ડ

આવક જાવકનો હિસાબ.

જ		ઉ	
૩૯૯૬૬-૦-૦	શ્રી વિરાણી સાર્વજનિક સ્કૂલ ફંડ ખાતે જમા	૩૮૭૮૯-૭-૬	શ્રી વીરાણી સાર્વજનિક સ્કૂલના મકાન ખાતે
૩૯૯૬૬-૦-૦			
		૯૪૧૦-૭-૩	સીમેન્ટ
		૩૧૩૧-૨-૦	લોખંડ તથા રંગના
		૧૧૮૨૧-૭-૦	લાકડું તથા નળીયાં
		૨૦૩૯-૮-૦	રેતી તથા ખડીના
		૧૬૦-૦-૦	ઝાડ તથા ભુંગા ખસેડવાની મજુરી
		૮૨૮૮-૯-૯	મજુરી
		૧૮૪૩-૭-૬	મોટરભાડું તથા કુવાનું ખર્ચ તથા પરચુરણ સામાનના
		૧૦૬૪-૧૪-૦	ઉદ્‌ઘાટન ખર્ચ
		૨૩૦-૦-૦	ઉદ્‌ઘાટન વખતે ફોટા લેવાયા તેના

realpatidar.com

realpatidar.com

સાર્વજનિક
વિદ્યાલય.
વિરાણી (કચ્છ)



પ્રમુખશ્રી
પ્રવચન કરે છે.
૬-૯-૫૩

realpatidar.com

https://archive.org/details/bk873/page/n15/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk873/page/n16/mode/1up

realpatidar.com

૬૦૦- ૦-૦	મોટર સ્ટેન્ડ માટે આપ્યા તે
૨૦૦- ૦-૦	શ્રી વિરાણી ગ્રામ વિકાસ સમિતિને આપ્યા તે
૧૨૫- ૦-૦	દાતાઓના નામની આરસની તકતી બનાવવાના
૯૮- ૯-૧	બ્લોક બનાવવા તથા છાપવાના
૧૦૫- ૦ ૦	રીપોર્ટની છપામણી વગેરે
૩૯૧૧૮- ૦-૬	
૮૪૭-૧૫-૬	શ્રી મનજી નારણજી પાસે પુરાંત બાકી
૩૯૯૬૬- ૦-૦	

રતનશી ખીમજી ખેતાણી
મનજી નારણજી લોહાર
ખીમજી દેવીદાન ગઢવી
શીવદાસ કાનજી પટેલ
નારાણ શીવજી નાકરાણી

realpatidar.com

https://archive.org/details/bk873/page/n17/mode/1up

realpatidar.com

મકાન ફંડનું લીસ્ટ

રૂા.	નામ
૫૧૨૫ા	પટેલ નારાણજી શીવજી નાકરાણી
૫૧૨૫ા	લુહાર નારાણજી ધનજી હા. તેમના સુપુત્રો
૫૧૨૫ા	પટેલ રતનશી ખીમજી ખેતાણી
૫૧૨૫ા	ગઢવી ખીમકરણ દેવીદાન
૫૦૦૧	પટેલ વિશ્રામ ભાણજી દીવાણીના સ્મરણાર્થે હા. વિરજી વિશ્રામ
૩૨૫૧	પટેલ મેગજી લખમશી પાંચાણીના સ્મરણાર્થે હા શામજી મેગજી
૨૦૦૧ા	પટેલ કાનજી વીરજી હા. શીવદાસ કાનજી
૧૫૦૦ા	પટેલ રામજી રાજાભાઇ
૧૦૦૧)	શાહ નારાણજી રવજીના ટ્રસ્ટીઓ તરફથી
૫૫૧)	લુહાર જેઠાભાઇ ધનજી હા. કરશન જેઠા
૫૦૧)	પટેલ ખીમજી નાયાં દિવાણી
૨૫૧ા	,, કરમશી મનજી માનાણી
૨૫૧)	પટેલ ભીમજી પ્રેમજી સોમજીઆણી
૨૫૧)	,, વિશ્રામ રાજા ,,
૨૫૧)	,, પચાણ લધા નાયાણી
૨૫૧)	બા શ્રી બાકુંવરબા
૨૫૧)	પટેલ શીવગણ ખીમા માનાણી હા. કરશન શીવગણ
૨૫૧)	,, શીવદાસ પરબત
૨૫૧)	,, નારણ દાના માધાણી
૨૫૧)	પટેલ સોમીલ (નાગપુર) હા. રવજી એન્ડ કરમશી કું.
૨૫૧)	,, પચાણ રતના માધાણી હા. નાનજી પચાણ

રૂા.	નામ	
૨૦૧)	,, કરશન મનજી	નાગપુર
૧૫૧)	,, શીવજી જેઠાની કું.	,,
૧૦૧ા	,, શામજીભાઇ અરજણ	,,
૧૦૧ા	,, વાલજી જશરાજની કું.	,,
૧૦૧ા	કચ્છ પાટીદાર સમાજ	જબલપુર
૧૦૧ા	કે. એલ. પટેલ એન્ડ કું.	,,
૧૦૧)	પટેલ રામજી નારાણ	નાગપુર
૧૦૧)	,, હંસરાજ દાના	બલારશા
૧૦૧)	,, જીવરાજ વાલજી લીંબાણી	
૫૧ા	,, જેઠાભાઈ અરજણ	નાગપુર
૫૧ા	,, મેઘજી દાના માધાણી	,,
૫૧ા	,, નારાણ રાજાની કું.	,,
૫૧ા	,, અરજણ નારાણ સોમજીઆણી	
૫૧)	,, અબજી પચાણ	નાગપુર
૫૧)	,, નારણ ધનજીની કું.	,,
૫૧)	,, જીવાજી લાલજી	,,
૫૧)	બલારશા ટીમ્બર ટ્રેડીંગ કું.	,,
૫૧)	પટેલ પચાણ કાનજી અખૈયાણી	
૪૫ા	,, માધવજી નાયા પાંચાણી	
૨૫ા	,, વિશ્રામ કાનજી	નાગપુર
૨૫ા	,, ડાહ્યાભાઈ ખેતા કું.	,,
૨૫ા	,, દેવશી વસ્તા એન્ડ બ્રધર્સ	,,
૨૫ા	,, રામજી એન્ડ મેગજીની કું.	,,
૨૫ા	,, ભાણજી મેગજીની કું.	,,
૨૫ા	,, રતનશી ડુંગરશી	,,
૨૫ા	,, નારણ શીવદાસની કું.	,,
૨૫ા	,, મનજી વાલજી સોમજીઆણી	
૨૫ા	,, પેથાભાઈ મૂળજી પાંચાણી	
૨૫ા	,, કરશન માવજી કાનાણી	

realpatidar.com

https://archive.org/details/bk873/page/n18/mode/1up

realpatidar.com

સાર્વજનિક વિદ્યાલય.

તા. ૬-૯-૫૩



વિદ્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે કાર્યકરો અને મહેમાનો, ડાબી બાજુથીઃ શ્રી. નારાણ શીવજી, શ્રી. જમિયતરામ ભાઈ, શ્રી. ઘાટગે સાહેબ, શ્રી. ભવાનજી અ. ખીમજી, શ્રી. શીવદાસ કાનજી, શ્રી. જેઠીજી સાહેબ, શ્રી. રતનશી ખીમજી વગેરે.

realpatidar.com

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk873/page/n20/mode/1up

realpatidar.com

૨૫૧ પટેલ વાલજી હરભમ નરસીગાણી
૨૫૧ ,, શીવગણ કરશન મુખી
૨૫૧ ,, માનણ માવજી ,,
૨૫૧ ,, પ્રેમજી લાલજી ભોજાણી
૨૫૧ ,, દેવશી રામજી તેજાણી
૨૫૧ એન. ડી. પટેલ એન્ડ કું. જબલપુર
૨૫૧ શ્રી કચ્છ વિજય સોમીલ ,,
૨૫૧ પટેલ માવજી હીરજી માનાણી ,,
૨૫૧ ,, વીરજી લાલજીની કું. ,,
૨૫) ,, હરીભાઈ એન્ડ હંસરાજ કું. ,,
૨૫) ,, વાલજી કરશન કાનજીઆણી
૨૫) ,, રઇયા લાલજી મુખી
૨૫) ,, લાલજી કાનજી તેજાણી
૨૫) ,, રતના હીરા મુખી
૨૦૧ શ્રી કૃષ્ણ સો મીલ નાગપુર
૨૦૧ બોમ્બે સો મીલ ,,
૨૦૧ રામજી પટેલ એન્ડ કું. જબલપુર
૨૦૧ પટેલ દેવજી રાજા એન્ડ કું. ,,
૨૦૧ વી. કે. પટેલ એન્ડ કું. ,,
૨૦૧ પટેલ વાલજી નાનજી એન્ડ કું. ,,
૨૦૧ ,, કાનજી ભાણજી ગોરાણી
૨૦) ,, દેવજી ધનજી વાલજીઆણી
૧૬૧ ,, ખીમજીભાઇ નથુ નાગપૂર
૧૫૧ શ્રી સત્યનારણ સો મીલ ,,
૧૫૧ પટેલ વાલજી ધનજી માધાણી ,,
૧૫૧ ,, સીવદાસ માના ,,
૧૫૧ સોની ઓધવજી ચાંપસી
૧૫૧ સોની પ્રેમજી શીવજી
૧૫૧ પટેલ અરજણ પબા ભાણજીઆણી
૧૫૧ લખમશી એન્ડ અંબાલાલ કું. જબલપૂર
૧૫૧ પટેલ ખેતા ગોપાળ કાનાણી
૧૫૧ ,, લાલજી ભાણજી બાથાણી

૧૫) પટેલ સામજી જેઠા ની કું. નાગપૂર
૧૫) ,, ખીમજી કરસન પાંચાણી
૧૫) ,, દેવજી લધા કાનાણી
૧૫) ,, જીવરાજ કાનજી તેજાણી
૧૨૧ ,, લાલજી સોમજી નાગપૂર
૧૧૧ ,, કરસન ભાણજી બાથાણી
૧૦૧ ,, ભાણજી કાનજી નાગપૂર
૧૦૧ ,, નાનજી દેવજી બ્રદર્સ
૧૦૧ ,, પુંજારામ રામજી નાગપૂર
૧૦૧ ,, પચાણો સીવજી સોમજીઆણી
૧૦૧ ,, વિશ્રામ વેલજી નાગપૂર
૧૦૧ ,, અરજણ રામજી ,,
૧૦૧ સોની હીરજી સુરજી
૧૦૧ લુહાર પ્રેમજી નારણજી
૧૦૧ પટેલ કાનજી વીરજી બાથાણી
૧૦૧ ,, પ્રેમજી નારણ કાનાણી
૧૦૧ ,, ખીમજી દાના ભાણજીઆણી
૧૦૧ ,, માવજી શીવદાસ સોમજીઆણી
૧૦૧ ,, હંસરાજ દેવજી છાભૈયા
૧૦૧ ,, રામજી એન્ડ વેલજીની કું. જબલપૂર
૧૦૧ સરદાર ગોવીંદસીંગ મલુપસીંગ
૧૦૧ પટેલ કાનજી ખેતસી જબલપૂર
૧૦૧ ,, વીરજી રામજી ,,
૧૦૧ એ. એમ. મીઠા એન્ડ કું. ,,
૧૦૧ ભવાનજી જાદવજી મહીન ,,
૧૦૧ પટેલ ખેતાભાઈ શીવજી રૂડાણી
૧૦૧ ,, ખીમજી જેઠા ખેતાણી
૧૦૧ ,, પ્રેમજી મનજી દીવાણી
૧૦૧ ,, કાનજી ખીમજી બાથાણી
૧૦૧ ,, હંસરાજ દેવશી ખીમાણી
૧૦૧ ,, ધનજી દાના અખીઆણી
૧૦૧ ઠક્કર કેશવજી મોરાર

realpatidar.com

https://archive.org/details/bk873/page/n21/mode/1up

1953-09-06 -Virani Sarvajanik Vidyalay (873)

realpatidar.com

૧૦)	પટેલ શીવદાસ દેવજી	
૧૦)	,, શીવજી અરજણ	
૧૦)	,, કરશન કાનજી સોમજીઆણી	
૧૦)	,, નારણ ખેતા સોમજીઆણી	
૧૦)	,, ભીમજી કાનજી કાનાણી	
૧૦)	,, શીવજી શીવગણ કાનાણી	
૧૦)	,, જીવરાજ રતના વાલજીઆણી	
૧૦)	,, અરજણ જેઠા વાલજીઆણી	
૧૦)	,, શીવજી લાલજી પાંચાણી	
પા	,, માવજી ખેતા	નાગપૂર
પા	,, કરશન વાલજી ધોળુ	,,
પા	,, સોમજી કરશનની કુાં.	,,
પા	,, લખમશી દેવશી	,,
પા	,, નથુ એન્ડ કરશનની કુાં.	,,
પા	,, નાગજી નારણ	
પા	,, સીવદાસ પ્રેમજી નાગપુર	
પા	,, દેવશી કરસન કાનજીઆણી	
પા	,, દેવશી ગોવા પોકાર	
પા	,, ડાયા ગોપાળ ઘોઘારી	
પા	,, નાનજી રામજી ભાવાણી	
પા	સોની ભાણજી દેવશી	
પા	પટેલ લધા જીવરાજ બાથાણી	
પા	,, અરજણ રાજા મુખી	
પા	,, વાલજી લખુ પરબતાણી	
પા	,, ભાણજી ગોવીંદજી	જબલપૂર
પા	પટેલ ડાહ્યાભાઇ મનજી	
પા	,, કરમશી રામજી	
પા	,, કચરાભાઈ વાલજી	
પા	,, રતનશી રાજા પાંચાણી	
૬ાા	,, વિશ્રામ ગોવા પોકાર	
પા	,, પચાણ પ્રેમજી ધનાણી	
પા	,, ખીમજી કરસન ધનાણી	
પા	,, મેઘજી નાનજી બાથાણી	
પા	,, કાનજી શીવગણ	
પ)	,, રામજી કરમશી પોકાર	
પ)	,, ગોપાલ ડાહ્યા	
પ)	,, મુલજી દેવશી	
પ)	,, ભાણજી મેઘજી વાલજીઆણી	
પ)	,, વેલજી ગોપાલ માધાણી	
પ)	,, હીરજી દેવજી છાભઈઆ	
પ)	,, અરજણ નારણ છાભઇઆ	
પ)	,, નાનજી લખુ પરબતાણી	
પ)	,, પેશાભાઈ નથુભાઈ	જબલપુર
પ)	,, વિશ્રામ જીવરાજ પાંચાણી	
પ)	સુથાર લાલજી ચનાભાઈ	
૪)	પટેલ ખેતા દેવજી નાયાણી	
રાા	,, પરબત ભીમજી નાગપુર	
રાા	,, દેવજી કેસરા વાડીયા	
રાા	,, નારણ દેવજી છાભઈયા	
રાા	,, કરસન સોમજી ,,	

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk873/page/n22/mode/1up

realpatidar.com

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk873/page/n23/mode/1up

realpatidar.com

अन्नदानात्परं नास्ति विद्यादानं ततोऽधिकम् ।
अन्नेन क्षणिका तृप्तिर्यावज्जिवं तु विद्यया ॥

અન્નદાનથી શ્રેષ્ઠ કોઈ દાન નથી, તથાપિ વિદ્યાદાન તેથી પણ અધિક શ્રેષ્ઠ છે, કારણ કે અન્નથી તો ક્ષણિક તૃપ્તિ થાય છે. ત્યારે વિદ્યાથી મનુષ્ય આજીવન તૃપ્તિ પામે છે.

શ્રી કાન્ત પ્રિ. પ્રેસ, ઘાટકોપર–મુંબઈ.

realpatidar.com